

--: અખબારી યાદી :-

## રાજકોટ મહાનગરપાલિકાનાં નવનિયુક્ત મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો

- રાજકોટમાં ૧૦૦ ટકા કોવિડ વેક્સીનેશનની કામગીરીને પ્રાથમિકતા
- લોકપ્રશ્નોનાં ઝડપી ઉકેલ અને લોકસુખાકારીની બાબતો અંગે ચૂંટાયેલી પાંખ સાથે સંકલન કરી તેઓના ફીડબેક સાથે કામગીરી પર ભાર મુકાશે
- રાજકોટમાં હાલ પ્રગતિમાં રહેલા તમામ મોટા પ્રોજેક્ટ્સ સમયબધ્ધરીતે પૂર્ણ થાય એ માટે કાળજી લેવાશે
- તમામ શાખાધિકારીશ્રીઓ સાથે પરિચય બેઠક પણ યોજી
- નવનિયુક્ત નાયબ મ્યુનિ. કમિશનર શ્રી આશિષકુમારે પણ ચાર્જ સંભાળ્યો

તા. ૨૪-૬-૨૦૨૧



(મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા)



(નાયબ મ્યુનિ. કમિશનરશ્રી આશિષકુમાર)



રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ આજે તા. ૨૪-૬-૨૦૨૧નાં રોજ સવારે પોતાનો પદભાર સંભાળી લીધો હતો. આ સાથે તેઓએ પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ કમિશનરશ્રીએ તમામ શાખાધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી સૌનો પરિચય મેળવ્યો હતો અને ક્યા અધિકારીશ્રી પાસે હાલ કઈ કઈ જવાબદારીઓ છે તેનો ચિતાર મેળવ્યો હતો. વિશેષમાં મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ એમ જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને નજર સમક્ષ રાખી રાજકોટમાં ૧૦૦ ટકા

કોવિડ વેક્સીનેશનની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવશે.

તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોઈ તેનો સીધો સંપર્ક નાગરિકો સાથે રહે છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સારીરીતે પ્રાપ્ત થાય તે ખુબ જ જરૂરી છે. મનપાની સેવાઓ સંબંધી લોકપ્રશ્નોના અને લોકસુખાકારીની બાબતો અંગે ચૂંટાયેલી પાંખ સાથે સંકલન કરી તેઓના ફીડબેક સાથે કામગીરી પર ભાર મુકાશે . સ્વાભાવિકરીતે જ નાગરિકો ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ સમક્ષ પોતાની રજૂઆત કરતા હોય છે ત્યારે પદાધિકારીશ્રીઓ અને નગરસેવકશ્રીઓ સાથે સંકલન અને તેઓના ફીડબેક સાથે વહીવટી તંત્ર પોતાની કામગીરી નિભાવે તે પ્રકારે આગળ ધપીશું.

સ્માર્ટ સિટી રાજકોટમાં હાલ વિવિધ ક્ષેત્રોનાં પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. હાલ પ્રગતિમાં રહેલા તમામ મોટા પ્રોજેક્ટ્સ સમયબધ્ધરીતે પૂર્ણ થાય અને નાગરિકોને વધુ ને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે કાળજી લેવાશે , તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રીએ કહ્યું હતું.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા